

૬.૧૧ જૈન સાધુઓની જીવન પ્રણાલી અને ગુણ પરિચય : ૧૦ ધર્મ.

મોક્ષને માટે જે મુનિ યત્ન કરે તે યત્ન અને યત્નિનો ધર્મ તે યત્નધર્મ. જૈન સાધુઓની જીવન પ્રણાલી અને ગુણો આજ યત્નધર્મને દર્શાવે છે. ભલે આ ધર્મ સાધુ જીવનનો છે પણ ગૃહસ્થ આધર્મનો શક્ય અમલ કરે તો ચિત્તમાં શાંતિ, કુટુંબમાં સંપ અને મૃત્યુ વખતે સમાધિ, પરલોકમાં સદગતિ, પરંપરાએ મોક્ષ પ્રાપ્તિ છે.

યત્ન ધર્મ ૧૦ (દસ) પ્રકારે છે.

૧. દ્વારા, ૨. માર્દવ, ૩. આર્જવ, ૪. મુક્તિ, ૫. તપ,
૬. સંયમ, ૭. સત્ય, ૮. શૌચ, ૯. અક્ષિંયન, ૧૦. બ્રહ્મચર્ય.

૧. ક્ષમાધર્મ :

આ દર્શાનામ યત્નધર્મના છે. તેમાં મુખ્ય ક્ષમાધર્મ છે. ક્ષમા તે પેટી છે. અલંકાર સાચવવાનો ડાબડો છે. જે ક્ષમા જાય તો બધા ગુણોનો નાશ થઈ જાય માટે જ ક્ષમાને દરવાજે કીધો છે. મોક્ષપ્રાપ્તિ ક્ષમાથી થાય છે. ઔદાર્યની પરાકાષ્ઠા જેટલી વધારે તેટલી ક્ષમા વધુ વિકસે છે. ક્ષમા સાથે ચૈતન્યની અપૂર્વ શાંતિ છે. માટે જ આત્મધરમાં રહેલો મુનિ કોધાદિદ્દપ પરદરમાં એટલે અશાંતિ થાય!

ક્ષમાથીજ નિર્વિકલ્પ દર્શાનો આનંદ પ્રાપ્ત થાય છે. માટે જ ક્ષમા પ્રધાન છે. તેનું નામ જ શ્રમાશ્રમણ માટે જ જીવનમાં ક્ષમાધર્મ વિશેષ આદરણીય છે. ક્ષમા એ ચંદન સમાન છે. ક્ષમા એટલે કોધનો અભાવ. આ ક્ષમા શાસ્ત્રમાં પંચ પ્રકારે કહેલી છે. ૧. ઉપકારક્ષમા, ૨. અપકારક્ષમા, ૩ વિપાકક્ષમા, ૪. વચનક્ષમા, ૫. ધર્મક્ષમા, ક્ષમાના બે ભેદ છે લૌકિક ક્ષમા અને લોકોત્તર.

ઉપકારક્ષમા : કોઈ પત્યે અપકાર સમયે સજજનવ્યક્તિ ઉપકારને યાદ કરી ક્ષમાભાવ રાખે તે ઉપકારક્ષમા

અપકારક્ષમા : અપકારી વ્યક્તિ સાથે જો હું સામો કોધ કરીશ તો તે ભવિષ્યમાં મારુ બગાડશે. સામો બળવાન હોય અને પોતે નિર્બળ હોય સહન કરી લે એમ વિચારિને ક્ષમા રાખવી તે અપકારક્ષમા.

ઉપકારક્ષમા સંસારવર્ધક છે જ અટે અપકારક્ષમા પણ સ્વાર્થીલી હોય સંસારવર્ધક છે. તે ત્યાગ કરવા યોગ્ય છે.

વિપાકક્ષમા : કષાયાદિ કરીશ તો તેનાથી મને કર્મનો બંધ થશે અને તેનાથી દુઃખ ભોગવવું પડશે દુર્ગાતિમાં જવાનું થાય તેના કટુવિપાકને વિચારી ક્ષમાભાવ રાખવો તે વિપાકક્ષમા આ ક્ષમા પહેલાની બે ક્ષમા કરતા કંઈક અંશે સારી કીધી છે જો કે આ સંસારવર્ધક તો છે જ પણ વિપાકફળને જાણી કરીએક આત્માને ઉપદેશથી લાભ મળે છે.

વચનક્ષમા: ભગવાનની આજ્ઞા છે કે કોધાદિ કષાય કરવો નહિં. ક્ષમા રાખવી – સમભાવ રાખવો તેમજ ગૃહાએ પણ ક્ષમાનો દિવ્ય સંદેશો પાઠવ્યો છે. શાસ્ત્રોમાં પણ ક્ષમા ધર્મની પ્રધાનતા બતાવી છે. આનાથી જિનેશ્વર ભગવાનના વચન પત્યે શ્રદ્ધા દર રાખવી તેનાથી આત્મા સમ્યગ્ દર્શન પ્રાપ્ત કરી આત્મકલ્યાણ કરનાર બને છે.

ધર્મક્ષમા : ક્ષમા તે આત્માનો ધર્મ છે. સ્વભાવ છે. એમ વિચારી સહજ ક્ષમાધારણ કરવી તે ધર્મક્ષમા. ગમે તેવા સંયોગોમાં ક્ષમાભાવ રાખવો – અપકાર કરનારને અપકારી ન માનતા કર્મનિર્જરામાં મદદગાર માને- ભાવઉપકારી માને દા.ત. ગજસુકુમાર ખંદકાચાર્ય – સુકોશલમુનિ –

વીરપરમાત્મા. કવિ કહે છે કે આત્મા ઉપર કરણા કરી રહેલા ભગવાન વીરને કોઈ કહે છે કે મારી ક્યારે જરૂર પડશે ત્યારે ભગવાન કહે છે કે મારે તારી જરૂર જ કયાં છે છતા પ્રભુને દેખ કે ખેદ ન થતા સંગમ દેવ પ્રત્યે કરણાભાવ આવ્યો ને સંગમ થાકયો. મારે શરણે આવેલો જીવ હારી જશે. તેના દૃઃખ્યી બે બિનદુ કરણાના પડી ગયા આવા પ્રકારની પરિણામ વાળી ક્ષમા તે ધર્મક્ષમા છે આ ક્ષમાથી જીવ આત્મદર્શન અનુભૂતિ કરતા કરતા સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે.

૨. માર્દવતા, (સરળતા) :

આત્માની કપટ રહિતપણાની અવસ્થાનો અનુભવ કરવો એ સરળતા કહેવાય છે. જ્ઞાનીભગવંત કહે છે કે જે કોઈ ધર્મઅનુષ્ઠાન કરો છો તેમાં આલોક અને પરલોકની ઈચ્છાથી કરોતો આલોકના દૃઃખ્યોના નાશ માટે કરેલી કિયા તે કપટવાળી છે તેનાથી પોતાનું હિત થતું નથી તે કિયા સંસારવૃદ્ધિનું કારણ બને છે.

આ ગુણવાળો આત્મા આયુષ્ય બાંધે તો મનુષ્યગતિનું બાંધે છે. દા.ત. મહિલાનાથ ભગવાને - પૂર્વભવમાં માયા કપટ કરી તપ ધર્મ કર્યો તો તે કર્મનો ઉદયથી સીવેદ ઉદયમાં આવ્યો. પણ હળુકમી આત્મા હતો કર્મ ખપાવી આવેલો તીર્થકરનો જીવ જે દિવસે દીક્ષા સ્વીકારી તે જ દિવસે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તેજ આ સ્વભાવની સરળતા સૂચક છે.

૩. આર્જવતા (નિરાભિમાનપણું) :

જ્ઞાનધર્મનું સેવન કરતા કરતા જે જીવને જ્ઞાન પ્રાપ્તિનું માન કષાય એટલે આત્મામાં અભિમાન રહેલું છે ત્યાં સુધી ધર્મકિયા મોક્ષપ્રાપ્તિ માટે સહાયભૂત બનતી નથી. માન-સંન્માન વિશેષરૂપે મળતાં હોય ત્યાં આનંદ માની જીવનને વિકસાવે છે. પણ તે ધર્મ મોક્ષ માર્ગ સફળ બનતો નથી. માન-પાન એ આલોકના સુખની વાંચા કહેવાય છે આથી સંસાર વૃદ્ધિ થાય છે માટે જ નિરાભિમાનપણું તેનેજ જ્ઞાનીએ ધર્મ કહ્યો છે જ્ઞાનીને જે જ્ઞાનમા અભિમાન આવી જાય તો તે જ્ઞાનનું અજીર્ણ છે. માટે જ આવા સમયે જે પચાવી શકે છે તે જીવનો અંતરમાં ક્ષયોપક્ષમભાવે ધર્મ પ્રાપ્ત થાય છે અને મુનિએ તેવું જ જીવન જીવવા માટે લક્ષ રાખી પ્રયત્નશીલ થવું જોઈએ.

૪. નિલોભતા :

સંયમજીવનમાં મુખ્યતા વસ્તુધર્મની છે. વસ્તુનો પરિગ્રહ લોભથી થાય છે સંયમી આત્માને વસ્તુ મળે યાન મળે પણ તેમાં મૂર્ખાં ન થવી જોઈએ. સંયમી ગોચરી જાય પણ લાંબાંતરાયના ઉદયથી નિર્દોષ આહારની પ્રાપ્તિ ન થાય તો મનમાં ખેદ કે ઉદ્ધેગ ન કરે અને વિચારે કે જીવે અનંતીવાર મન ગમતા રસોનો સ્વાદ લીધો છે પણ આ મુનિજીવનમાં મળે તો હર્ષ ન થાય. શરીર ટકાવા પુરતુ આહાર વાપરે અને ન મળે તો તપોવૃદ્ધિ... સંયમપુરુષ થશે એ ભાવના રાખીને લોભવૃત્તિનો નાશ કરવો એ ધર્મકહ્યો છે શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ જીવ પોતાના ભૂજાબળથી સ્વયંભૂરમણ સમુદ્રને તરી જાય છે અને તેમાં જે પરિશ્રમ - થાક લાગે છે એટલો થાક જીવનને લોભ કષાયને કાટવામાં લાગે છે. લોભના અનંતાનંત ટુકડા કરીને તેનો નાશ કરે છે તે નાશ આત્મકત્યાળાની ભાવનાથી કરાતો હોવાથી જીવને નિલોભતા અને મુક્તિગુણ સહજ પ્રાપ્ત થાય છે. લોભકષાય સર્વવિનાશક છે. આજ કારણે મહાપુરાષો ફરમાવે છે કે વ્યાધિઓનું મૂલ જેમ રસ છે ને દૃઃખ્યુનું મૂલ જેમ સ્નેહ છે તેમ પાપોનું મૂલ લોભ છે. દશવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે કે કોહોપીએપણાસેઈ માનોવિનયનાસનો માયામિતાણિ નાસેઈ લોહો સવ્ય વિનાસણો માટે મુનિએ આ લોભવૃત્તિનો નાશ કરી નિલોભતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જરૂરી છે.

૫. તપદર્મ :

ઉપરના ચારગુણો જે યતિધર્મના કહ્યા તેને પ્રાપ્ત કરવા માટે ટકાવવા માટે જ્ઞાની ભગવંતો તપદર્મ કહ્યો છે. સંયમી ઈચ્છાનિરોધ વૃત્તિ રાખીને સંયમ સાધના કરે ત્યારે અશુભ કર્મનો નાશ થાય છે. બાંધેલા નિકાયિત કર્મોને તપ વડે તપાવે છે. તે તપ ધર્મ કહ્યો છે. સંસારનું વિરામ સ્થાન લાવવું હોય તો તપ ધર્મની આરાધના કરવી જ પડે છે. તીર્થકર કેવળી ભગવંત કે કોઈપણ આત્મા મોક્ષમાં જતા પહેલા નાનું - મોટું તપ કરીને જ જાય છે. માટે મુનિજીવનમાં આરાધના ઉપાસનાનું લક્ષ તે જ કર્મ નિર્જરા - અને તે તાત્કાલિક ફળ આપનાર છે.

તપ એ સાત્ત્વિક ભોજન છે મનની મલિનતાને જીતવા માટે પણ તપદર્મ શ્રેષ્ઠ છે.

આગારના ત્યાગી કાંતો અણાગાર રાગી તપ વગારના કચારે પણ ન હોય. બાહ્યતપથી બાહ્ય સામગ્રીની પ્રાપ્તિ અને અભ્યંતર તપથી આંતરીક ગુણોની પ્રાપ્તિ કહેલી છે સમતાભાવે અને આકંદ્ધા વગાર કરે તો તપ મુક્તિની નિકટ જીવને લઇ જાય છે માટે જ્ઞાનીએ અણાગારને તપસ્વી કહ્યા છે. માટે મુનિએ તપદર્મનું આરાધન નિરતિયાર પણે કરવું જરૂરી છે.

૬. સંયમ :

સાધુજીવનમાં ૧૭ પ્રકારના સંયમનું પાલન નિરતિયાર પણે કરવાનું છે. ૫ ઈન્દ્રિય, ૪ કષાય, ૫ અવ્રત અને ૩ યોગ અને ૧૭ આશ્રવનો નિરોધ કરવો એટલે સંયમ કરવો તે સંયમ કહેવાય છે. પાંચ મહાવ્રતોની અનુભૂતિ કરવી તે સંયમધર્મ છે. અષ્ટપ્રવચન માતા તે સાધુજીવનને જાગૃત બનાવે છે તેથી તે ધર્મયોગ કહેવાય છે પાપથી અટકવા માટેની અષ્ટપ્રવચનમાતા તે વાડ સમાન છે કષાય ઉપશાંતદંદિષ્ટ ઈન્દ્રિય દમન ને કાયા દ્વારા પાપયોગની નિવૃત્તિ તે ધર્મયોગ - નિદ્રા - અંધકાર - એકાંતમાં શુભવિચારોની દારાએ સંયમ છે. સાધુતાના ગુણો જોવા માટે ચર્મચક્ષુ નિરર્થક છે પણ આંતર્ચિક ચક્ષુથી જુવે તો તે સાચા સાધુતાના સંયમના દર્શન કરે છે. માટે સંયમીએ સંયમજીવન નિરતિયારપણે પાળવા પ્રયત્ન કરવો.

૭. સત્યધર્મ :

સત્ય એટલે હિત-મિતને પદ્ધ્યવાળી બોલવી તે. હિત એટલે હિતકારી સંસારમાં રઝળતા જીવોને હિતકારી બુદ્ધિથી જ્ઞાનીના વચનો સમજાવવા તે હિતકારી બને છે. મિત એટલે અત્ય શાબ્દવાળું. થોડા શાબ્દથી સમજુ શકાય વધુ શાબ્દનો પ્રયોગ ન કરે દા.ત. ચિલાતીપુત્ર - જંગલમાં સુખમાનું મસ્તક લઈને મહિ અને રાગમાં અંધબની દોડી રહ્યો છે પણ જ્યાં જંગારણ મુનિ મત્યાને તેમના પ્રણ શાબ્દો ઉપશામ - વિવેક સંવર - આ શાબ્દો ના ભાવને હૃદયસાત્ત કરવા તેજ રાગી ત્યાં ત્યાગી બન્યો સત્યધર્મ જણાયો ત્યાં જ આત્મધરમાં વસ્યો.

પદ્ધ્ય એટલે પ્રિયકારી શાબ્દોનો પ્રયોગ કરવો. બીજાને દુર્વચનો કહેવા ગાળો દેવી - સામાને દુઃખ થાય તેવી ભાષા ન બોલવી તે પદ્ધ્યવાળી છે. પરમાત્માની આઙ્ગા મુજબના જે વ્રત-નિયમ-પરચાક્ખાણ કરેલા હોય તેને અખંડ રીતે પરિપાલન કરવું એ પણ સત્યવચન છે.

પૂર્વકાળમાં હરિષચન્દ્રરાજા થઈ ગયા તે સત્યવાદી તરીકે પંકાયા. પોતાની પ્રાણાઘારી પત્ની અને પુત્ર રોહિતનો સત્યવચન ખાતર ત્યાગ કર્યો પણ જીવનમાં અસત્યભાષાનો આશરો ન લીધો. વળી દુઃખો પર્ચિસહો જે કંઈ કર્મ ભોગાય્યા તેમાં કર્મપ્રદાન માની સત્યવચન. સત્યધર્મ છોડ્યો નહીં માટે સાધુપણ સત્યવચનનું જીવનમાં આચરણ કરે. પ્રભુવીરે મરીયીના ભવમાં પ્રિંદંડી બન્યા છતાં સત્યધર્મ છોડ્યો ન હતો હિતની પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિ તોજ મુક્તિ નિકટ છે અહિતની નિવૃત્તિને બેકગ્રાઉન્ડ છે હિતની પ્રવૃત્તિ તે ઉપરની ચાદર છે. માટે સાધુ હંમેશા હિત-મિત પદ્ધ્ય વચનગ્રાહી હોય છે. તે પ્રમાણે આચરવું તે સત્યધર્મ છે.

૮. શૌચધર્મ :

પવિત્રતાને જીવનમાં અપનાવી તે શૌચ-પવિત્રતા એટલે શરીર પવિત્ર રાહવું.

૧. પવિત્રતાના શરીરની પવિત્રતા અને આત્માની પવિત્રતા તેમ જ્ઞાનીએ બે પ્રકાર જણાવ્યા છે. મળેલા માનવ દેહને સ્નાન વિલેપન તથા મર્દન દ્વારા સ્વચ્છ કરવું તેમાં પુષ્ટતા અનુભવી શરીર પર મમત્વભાવ તે શરીર શૌચતા કહી છે. તે ત્યાજ્ય છે.
૨. શરીરદ્વારા ધર્મના પરિણામરૂપ અદ્યવસાયનો સંયમરાખી આત્મઉદ્ઘૃતિની વારંવાર વિચારણા કરવી શુભ અદ્યવસાયમાં સ્થિર બનવું તે ભાવ શૌચતારૂપ યતિધર્મ કહેલો છે. શરીર અને આત્માનો સંબંધ - વ્યંજન અને સ્વર જેવો છે આત્મા એ દેહ નહીં પણ દેહી છે. શરીર એ શરીર નહીં પણ શરીરી છે. શરીર મમત્વ એ દ્રવ્ય શૌચ અને આત્મઉદ્ઘૃતિ એ ભાવ શૌચ છે. યથાર્થ્ પ્રગતિ કરવામાં સહાયભૂત તત્ત્વથે ભાવ શૌચ ધર્મ છે માટે યતિ જિનેશ્વરદેવની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કરવાનો પરિણામ જે જીવ આમાં સ્થિરતા કેળવે છે તેને થતો નથી તે શૌચ ધર્મ કહેવાય છે મૈગ્રાહિ ભાવના વડે ચિત્તનું પ્રક્ષાલન કરવું તે દ્રવ્ય શૌચ છે.

૯. અક્ષિંયન (અપરિગ્રહ) :

જીવની પાસે રહેલ જે જે પદાર્થો દીઢ કે અનિષ્ટ તેના પર મુચ્છા થવી મમત્વભાવ થવો તે પરિગ્રહ છે અને તે મુચ્છાનો જેટલે અંશે ત્યાગ એટલો જીવનો અપરિગ્રહતા રૂપ ધર્મ કહેવાય છે.

સાધુને નિષ્પરિગ્રહી કહ્યા છે. પરિગ્રહના ભારથી સાધુજીવન ભારે બને છે. અને દુર્ગાતિના દ્વારે પહોચાડે છે. નિંગ્યંથતા ધારણા કરનાર સાધુ પ્રતિજ્ઞાપૂર્વક પાપનો ત્યાગ કરી છકાય જીવની રક્ષામાં ઉપયોગવંત હોય છે. પ્રતિજ્ઞાના પાલનામાં આત્મશક્તિનો વિકાસ છે પ્રતિજ્ઞા એ બંધન નથી પણ કર્મ જંજુરને તોડવાનો પોલાદી કથોડો છે. આત્મધર તરફ લઈ જનાર દીપક તુલ્ય છે. માટે જ સાધુને બે પ્રકારના પરિગ્રહ કહ્યા છે. બાહ્ય પરિગ્રહ ને અભ્યંતર પરિગ્રહ બાહ્યપરિગ્રહ નવ પ્રકારનો છે તે પરિગ્રહ સાધુને સાધનામાં અંતરાય પેદા કરનાર હોવાથી હંમેશા ત્યાગ કરવા યોગ્ય છે. જ્યારે અભ્યંતર પરિગ્રહ ચૌદ્યપ્રકારનો છે તે પરિગ્રહ પણ છોડવાનો છે. તેથી તેના અભ્યાસ માટે સંયમનો સ્વીકાર છે ને લક્ષ્ય પણ નિષ્પરિગ્રહી બનવાનું હોય છે. ખરેખર મુનિજીવન એ વ્યાદિ જીવન નથી પણ સમાચિત જીવન છે. આ ધર્મના સેવનમાં સંયમીએ પ્રયત્નશીલ બનવાનું છે.

૧૦. બ્રહ્મચર્ય :

“તે વ્રત જગતમાં દીવો જગમાં દીવો મેરે ધ્યારે તે વ્રત જગમાં દીવો” ખરેખર અબ્રહ્મનું સેવન તે મહાદોષોનું કારણ છે. બ્રહ્મ એટલે આત્મા તેને વિશે ચર્ચા એટલે ચરવું-ફરવું આત્માની વિચારધારામાં રમવું. આત્માઉત્થાનમાં કે આત્મીક ગુણોના વિકાસ માટે ઉદ્યમી બનવું અને તે શુભ વિચારમાં સ્થિર બનવું એટલે મન-વરણ કાયાથી મૈથુનનો ત્યાગ કરવો. તે બ્રહ્મચર્ય કહેવાય છે.

બ્રહ્મચર્યના અટારભેદ વર્ણાચારા છે. પૂર્વકાળના જે મહાપુરુષોને સતીએ જે દીતિહાસના પાને લખાઈ ગયા તેનું મુખ્યકારણ શીલધર્મનું પાલન છે બ્રહ્મચર્યના પાલનથી આત્મામાં સૌમ્યતા તેજસ્વીતા અને મંત્ર-જાપ વિગોરેની ફળીભૂતતા પ્રત્યક્ષ જણાય છે. આત્મા અનંત ભવોથી કામવાસનાને પરવશ બની સંસારમાં પરિભ્રમણ કરે છે. જ્યારે કામજનિત સુખ એ સુખ નથી પણ સુખના અભ્યાસમાં ભયંકર કોટીનું દુઃખ છે. બ્રહ્મચારીના પ્રસ્વેદથી પણ રોગ-વ્યથા કે સંકટ દૂર થાય છે. આ કાળમાં પણ ધર્મને અને અબ્રહ્મને જાણી ધણા આત્મા

નાની વયમાં સંસાર ત્યાગી ગુરુકૂળવાસમાં અને જિનાજ્ઞામાં રહીને સંયમની સાધનામાં મસ્ત હોય છે. બ્રહ્મયર્થની નવપ્રકારની વાડ જે ઝાનીએ જણાવી છે તે મુજબ આત્મકલ્યાણકારી કિયા દ્વારા બ્રહ્મયર્થનું પાલન કરી સ્વપર ઉપકાર કરે. જે બ્રહ્મયર્થ વ્રત તે અહિંસાને સતેજ બનાવેછે. શ્રમણજીવનની ગુંખના અનુતાર વિમાનવાસી દેવો પણ કરે છે. આવા બ્રહ્મયર્થપ દશમો યતિધર્મ તેના પાલનથી અશુભ કર્મો રોકાય છે. અને કદાચ જે અશુભ કર્મો આત્મામાં આવે છે. તે અત્ય રસવાળા ને અત્ય સ્થિતિવાળા આવે છે. આવો જે યતિધર્મ દશ પ્રકારનો તેને સંવર કહેવામાં આવે છે.

દશ પ્રકારની સમાચારી સાધુજીવનમાં નિત્યવ્યવહારમાં કેવી જાગૃતિ પૂર્વક વર્તવું જોઈએ તે પણ જણાવે છે. ઈચ્છાકાર - મિરછાકાર - તથાકાર આવસ્સહિ - નિસીહી - આપુરછા - પ્રતિપુરછા - છંદના - નિમંત્રણા - ઉપસંહારરૂપ દશ સમાચારી છે.

૧. ઈચ્છાકારી : કોઈપણ કાર્ય નાના સાધુ પાસે કરાવવું હોય તો તેની ઈચ્છા પ્રધાન બનાવું જોઈએ.
૨. મિરછાકારી : થયેલી ભૂલનું પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થવું.
૩. તથાકાર : વડિલ - ગુરુ જે કંઈ આજ્ઞા કરે તેણે પૂર્ણ કરવા તેને તહેતિ કહીને સ્વીકારવું.
૪. આવસ્સહિ: સાધુએ પોતાની વસ્તીમાંથી બહાર તેમજ દહેરાસરમાં - ઉપાશ્રયમાંથી જતા આવસ્સહિ કહેવું જોઈએ.
૫. નિસીહી : સાધુએ પોતાની વસ્તીમાંથી બહાર તેમજ દહેરાસરમાં - ઉપાશ્રયમાંથી બહાર ગયા પણી પાછા આવતા પ્રવેશ કરતા નિસીહી કહેવું જોઈએ.
૬. પૂરછા : ગુરુને પૂછીને સર્વકાર્ય કરવું. પૂછીને કાર્ય કરવાથી સંયમની સાધનામાં ઉજમાળ બને છે.
૭. પ્રતિપુરછા : દરેક કાર્ય વારંવાર પૂછીને કરવું જોઈએ કોઈ વિશિષ્ટ કાર્ય હોય તો પણ વારંવાર પૂછવું જોઈએ.
૮. છંદના : સાધુએ લાવેલો આહાર આદિ તથા અન્ય મુનિભગવંતે લાવેલા આહાર માટે પ્રાર્થના ગુરુઆજ્ઞાને અનુસરી અન્ય સહાય્યાચી મુનિને કરવી.
૯. નિમંત્રણા : ગુરુ-બાળ-વૃદ્ધ-ગલાન-તપસ્વી વૈયાવર્યકારકને પોતે લાવેલી ગોચરી આહાર માટે આમંત્રણ આપવું તે આસમાચારી સૂચવે છે.
૧૦. ઉપસંપદા : પોતાના ગુરુની પાસે જેને સૂત્ર અર્થ ગ્રહણ કરયો હોય તે અથવા ગુરુ આજ્ઞાથી બીજા આચાર્ય પાસે સૂત્ર અર્થ ભણાવા મોકલવામાં આવે તે ઉપસંપદા.

આ સમાચારીના પાલનમાં ઉપયોગવંત જીવનો જીવનમાં સદાચારનો ભંગ કે તેના ફળસ્વરૂપ કર્મબંધ થવાનો અવકાશ રહેતો નથી.